

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૬/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૩૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૪ કેસ કરી, ૩૩ વ્યક્તિઓને ઝડપી, ૪૯૭ લીટર દેશી દારૂ, ૧૮૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૪૦ બીયર ટીન, ૦૧ કાર, ૦૧ સ્કુટર અને ૦૧ મોટર સાયકલ કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯૭,૨૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૪૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૦૪૧/૧૮

અમરાઇવાડી : અક્ષયભાઈ સુરેશભાઈ જૈન (રહે, પ્રણવ ફ્લેટ મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે પાલડી) એ તા.૧/૬/૧૮ નારોજ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૧૨/૧૭ તથા ૦૮/૦૧/૧૮ ના રોજ અમરાઇવાડી સુખરામનગર ઉત્તમ ડેરી પાસે, ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં.૪ માં આવેલ બાગરેયા ટ્રેડિંગ નામની દુકાન ખાતે આરોપી હિતેષભાઈ ઇન્દ્રવદનભાઈ સોની (રહે, વિનયનગર મઢીની ખમણી રોડ ગુરુદ્વારા સામે ઉધના સુરત) એ અક્ષયભાઈ નો પ્લાસ્ટિક ની થેલીનો માલ લઈ જઈ, માલના નાણા પેટે ચુકવવાના થતા કુલ રૂપિયા ૪,૬૮,૫૭૮/- નહી ચુકવી આપી, અક્ષયભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી એમ.એમ.તેજોત યલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૦૪૨/૧૮

નારણપુરા : નીશાબેન ડો/ઓ મનસુખભાઈ વસાવા (રહે, નિધી એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગર નારણપુરા) એ તા.૧/૬/૧૮ નારોજ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૫/૨૦૧૮ બપોરના ૦૧/૦૦ થી તા.૦૧/૬/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરનું લોક તોડી, અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી કબાટમા મુકેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૬,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી ડી.એચ.ચૌધરી યલાવે છે.

રાણીપ : અક્ષય કનૈયાલાલ ઓજા (ઉ.વ.૨૩)(રહે,રામદર્શન રો હાઉસ કાશીબા રોડ રાણીપ) એ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૬/૨૦૧૮ ના કલાક ૧/૩૦ થી ૬/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમા પ્રવેશ કરી, તિજોરીના ડ્રોવરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨,૭૬,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી વી.આર.ચાવડા ચલાવે છે.

બાપુનગર : નિરજબેન વા/ઓ સુરેન્દ્રસિંગ પવાર (રહે,રામદેવનગર ગજાનંદ એસ્ટેટ સામે, નાગરવેલ હનુમાન બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૫/૨૦૧૮ સાંજના ૫/૦૦ થી તા.૦૧/૦૬/૧૮ બપોરના ૨/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૮,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા ચલાવે છે.

ઇસનપુર : જયેશકુમાર નવનીતલાલ સોની (રહે,વૈભવપાર્ક કેડીલા બ્રીજની બાજુમા ઘોડાસર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૧/૦૫/૧૮ રાતના ૦૮/૦૦ થી તા.૦૧/૦૬/૧૮ સવાર ના ૮/૩૦ વાગ્યા દરમ્યાન ઘોડાસર, કામેશ્વર કોમ્પ્લેક્ષમાં આવેલ પોતાની “અલંકાર જ્વેલર્સ” નામની પોતાની દુકાનના લોખંડના દરવાજા ના નકુચાને તોડી, અજાણી વ્યક્તિ દુકાનમા પ્રવેશ કરી, દુકાનમાંથી ચાંદીના દાગીના તથા ડી.વી.આર. કિંમત રૂપિયા ૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૪,૫૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી બી.સી.ઇત્રાલીયા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૦૪૩/૧૮

નિકોલ : પારૂલબેન કિશનસિંહ ઠાકોર (ઉ.વ.૨૦)(રહે,વડવાળી ચાલી સિંગરવા તા.દસ્કોઇ જી.અમદાવાદ) એ અગમ્ય કારણસર તા.૩૧/૦૫/૧૮ સાંજના ૦૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી સુરવિરસિંહ સ્વરૂપસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.